

Q-1 મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી તેની સમજૂતી આપો .

14

અથવા

Q -1 સંઘર્ષ એટલે શું ? સંઘર્ષના પ્રકારો વર્ણવો .

Q- 2 નીચેના માંથી કોઈ પણ ત્રણ ટૂંકા પ્રશ્નોનાં ઉત્તર આપો.

6

- 1) સી ટી મોર્ગનની મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપો .
- 2) પ્રેરણા એટલે શું ? માર્ગનની વ્યાખ્યા આપો.
- 3) મનોભારમાં કોનો ફાળો મુખ્ય છે ?
- 4) યુવાવાસ્થામાં ક્યાં બોધાત્મક પરિવર્તનો આવે છે ?
- 5) ભૂખના વર્તનના નિયંત્રણ માટેનાં બે અગત્યના પ્રદેશો ક્યા છે ?

P. S. Science & H. D. Patel Arts College, Kadi

B. A. Semester: I

Unit Test-2

Psychological and Effective Behavior (E.O)

Time: 10:10 to 11:10

Total Marks: 20

Date: 03/10/2018

Q - 1 સંઘર્ષ એટલે શું ? સંઘર્ષના પ્રકાર વર્ણવો.

12

અથવા

Q-1 વ્યક્તિગત વિકાસમાં માનોભારનો ઉપયોગ ચર્ચો.

Q-2 નીચેના માંથી કોઈ પણ ચાર ટૂંકા પ્રશ્નોનાં ઉત્તર આપો.

8

- 1) હતાશાના ભાવ્ય કારણો ક્યાં છે ?
- 2) મનોભાર અંગેની જી. સી. કોલમેનની વ્યાખ્યા આપો.
- 3) ભય અને વ્યગ્રતા વચ્ચેનો તફાવત શું છે ?
- 4) ગુસ્સો- આક્રમકતા ઉપર નિયંત્રણ કઈ રીતે કરવું ?
- 5) માનોભારનો મુકાબલો કરવા માટેની કઈ અંતર્ગત પ્રતિક્રિયાઓ છે ?
- 6) ખાધવિકૃતિઓ કઈ કઈ છે ?